

કુક્ત ઈમાભી ઈસ્માઇલીઓ માટે

૫૯માણિ મુખ્ય ૨૫

૩૧૩

ફક્ત ઈમામી ઈસમાઈલીઓ માટે

હ. ઈમામ સુલતાન મુહમુદ્દશાહ

તથા

પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાજર ઈમામના

પવિત્ર

ફરમાન મુખારક

૩૧૩

-: સંગ્રહકર્તા :-

“અભ્યાસી”

સેવક મહમદઅલી ઈબ્રાહીમ નાનજી

ઠ. રોશન વીલા, સી-ઉર-એ, બ્લોક-૫, ફેડરલ બી,

અરીયા, કરાંચી - ૩૮.

બે બોલ

ઈસ્માઈલીઓનું એ ગૌરવ છે કે ઈસ્લામના આરંભથી આજ દિવસ સુધી રૂહાની પ્રકાશની દુનિયા ઈમામત સાથે એક સત્ય તરીકે રહેલ છે. આ અનોખી પ્રણાલિકા પ્રમાણે દરેક વખતના ઈમામ પોતાના મુરીદોને દુનિયાની જવાબદારીઓને સંભાળવા સાથે પોતાના મકસદને હાંસલ કરવા યોગ્ય હિદાયત ફરમાવે છે.

આ પ્રકાશનમાં ઈમામે જમાનના અમુલ્ય જવેરાતોરુપી ફરમાનો સમાવવામાં આવ્યા છે, જે રૂહાની ઈલ્મ (સમજ), ઈશ્ક, ઈમાન અને ઈબાદતના વિષયો પ્રમાણે કમવાર ગોઠવવામાં આવેલા છે.

જે દીનદાર ભાઈઓ પોતાની જાતનો રૂહાની વિકાસ કરવા, જેઓ આપણા દીન વિષે વધારે સારી સમજ મેળવવા તેમજ જીવનનો આંતરિક અર્થ જાણવા અને પોતાના રૂહને ઊંચે દરજજે લઈ જવા ચાહે છે; તેમને આ ફરમાનોની સાંકળ ઘણીજ સહાય રૂપ થશે.

આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ (ઈલ્મ) જે થકી રૂહાની ઈશ્ક અને રૂહાની ઈશ્ક થકી બાતુની ઈબાદત શક્ય છે જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જે એકાગ્રતા થકી ઈન્સાન જીંદગીના મકસદને પામે છે.

મજુર મકસદને પ્રાપ્ત કરવા ચાહતા દીનદારોને સહાયરૂપ થવા માટે આ પ્રકાશન મી. મહમદઅલી ઈબ્રાહીમ નાનજી “અભ્યાસી” અને તેમના સાથીદારોએ બહાર પાડેલ છે.

* નુર ઈલાહી અવલ થા
 સો આખર જગમેં પાયા ઝડુર,
 ઈસી દીનકે તાબે હોવે,
 ઉસમે રોશન હોવે રબકા નુર,
 ખતમ કીયા ઈસ કલામઙું,
 સબ જાહેર કહે સુનાયા,
 સો પડો શિખો સુનો ઓર સુનાઓ,
 યુ મૌલાને હુકમ ફરમાયા.

* ભરતબા ઈલ્મ કેરા,
 સબ હુન્દર ઉપર હએ આલા,
 કે ઈલ્મસે તો રબ પહેચાના,
 જને અપના દિલ ઉજાલા,
 ઓર હુન્દર કમાઈ સબ ફના હોવે,
 પહેચાન ખુદાકી રહેવે બાકી,
 એ સુનો સમજો યાદજ રાખો,
 ફરમાયા કઉસરે સાકી.

પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાજર ઈમામે
ફરમાવ્યું :

અમારા ઘારા પુજનીય યાદના દાદાજાનની
સંપૂર્ણ ઈચ્છા અને નિમણુંક મુજબ પવિત્ર
ઈમામતની મારી ગાદીનશીની નિમિતે અમો
આખી દુનિયાના બધા વ્હાલા રૂહાની
બચ્યાંઓને અમારા માતા અને પિતા તરીકેના
ઉત્તમ દુઆ આશિષો ફરમાવીએ છીએ.

નુર મૌલાના શાહ કરીમ હાજર ઈમામે
ઈમામતની ભસનદ ઉપર બિરાજમાન થયા બાદ
શાનિવાર તા. ૨૦-૭-૧૯૫૭ના જીનીવા ખાતે
વીલા બરકતમાં ત્યાં ખાતે હાજર રહેલા મુરીદો
વચ્ચે પહેલીજવાર મુખ મુખારકથી ફરમાવ્યું:

તમો મારા સધળાં રૂહાની બચ્યાંઓને અમે
ઘણા દુઆ આશિષ ફરમાવીએ છીએ અને દુઆ
કરીએ છીએ કે તમે સુખી અને આબાદ રહો.

ફરમાન મુખારક ૩૧૩ ... (૫૪)

અમારા દાદા પ્રત્યે તમોએ જે ભક્તિભાવ
અને વફાદારી બતાવી છે તેની અમારા હિલ
ઉપર ઘણી ઊંડી અસર થઈ છે.

અમારા દાદાએ જુંદગીના છેવટ સુધી પોતાના
રૂહાની બચ્ચાંઓની ભલાઈ માટે કામ કર્યું હતું.
અમો પણ અમારી જુંદગી તમોને અર્પણ કરીએ
છીએ.

અમારા જીલા રૂહાની બચ્ચાંઓ, અમો
તમારી સમક્ષ બોલી રહ્યા છીએ એ સાથેજ
તમારા આગલા ઈમામની યાદીઓને અમારી
અંજલિ અર્પણ કરીએ છીએ.

જ્યારે આપણો એવણને યાદ કરીએ છીએ
ત્યારે એવણની ઘણી ઘણી યાદો આપણા
ઝ્યાલમાં આવે છે.

એવણની જુંદગી દરમ્યાન એવણો આપણી
કોમ માટે જે હાંસલ કર્યું છે તે સાધારણ રીતે
કામયાબ કરતાં કેટલીક સદીઓ વીતી જાય છે.
એમનાં કાર્યો કેટલાં ભવ્ય અને પ્રભાવશાળી
હતાં એ દુનિયાએ એમને જે અંજલિઓ આપી,
એ સાચી રીતે પુરવાર કરે છે.

એવણ અમારા માટે પ્રેરણાદ્યક હશે અને
અમના નકશો-કદમ ઉપર ચાલવાની હુંમેશા
અમારી સંપૂર્ણ ઈચ્છા રહેશે.

આત્મા માટે બંદગી અને શરીર માટે કસરત
કરવા સાથે શુભેચ્છા અને સહકારની ભાવના
કેળવશો તો તમોને હુંમેશાં સફળતા મળશે.

ઈન્સાનમાં બે ચીજો છે, એક શરીર અને
બીજો આત્મા.

આત્માને ઝુહાની ખોરાકની જરૂર પડે છે.
તેજ પ્રમાણે શરીરને કસરતની જરૂર પડે છે.

સુખની એક માત્ર ખાત્રી પૂર્વકની ચાવી છે તે
છે ઈબાદત.

તમારામાંના ઘણાને એ સમજાશે કે જ્યારે
તમારો મુસીબતનો સમય હોય અથવા
વ્યક્તિગત ગમ હોય તો તેના નિવારણનો માત્ર
ખરો ઈલાજ ઈબાદત છે.

પરંતુ માત્ર મુસીબતના વખતમાંજ બંદળી
કરો તેમ ન હોવું જોઈએ.

સુખના દિવસોમાં પણ ઈબાદત કરવી જોઈએ
કારણ કે તે તમને ઈન્સાનિયતના ગુણો બક્ષશે
જે તમારામાં હોવા જોઈએ.

સેંકડો વરસથી અમારા રૂહાની બચ્ચાઓ
ઈમામતની રસી દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે.

તમોએ સઘળી બાબતોમાં સલાહ અને સહાય
માટે જમાનાના ઈમામ તરફ દ્રષ્ટિ કરી છે અને
તમારા ઈમામને પોતાના રૂહાની બચ્ચાઓ પ્રત્યે
અતિશય પ્રેમ અને વહાલ હોવાથી, તેમના નુરે
તમારી રહેનુમાઈ કરેલ છે કે તમારે રૂહાની અને
દુન્યવી સંતોષ પ્રાપ્ત કરવા કયાં અને કઈ
દિશામાં મોહું ફેરવવું જોઈએ.

ઈમાન એ મોટામાં મોટી વસ્તુ છે. રસ્તામાં
ધૂળ પડી હોય તેની કંઈ કિંમત નથી, તેમ ઈમાન
વગરના માણસની કિંમત ધૂળ ભિસાલ છે.

મજહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઈન્સાન
ધુળ મિસાલ છે અને તે વિના તેની જુંદગી અર્થ
વગરની છે.

ઈમાનવાળા ગરીબ માણસનું જીવન, ઈમાન
વગરના ધનવાન કરતાં ધણુંજ કિંમતી છે.

અમારા વ્હાલા રૂહાની બચ્ચાંઓ, એક મુદ્દો
ધણી જબરી મહત્વતા ધરાવે છે, અમો ઈચ્છીએ
છીએ કે તમો હંમેશા એ યાદ રાખો કે તમો
તમારી જુંદગી દરમ્યાન જમાતખાનાની
હાજરીમાં નિયમિત રહેશો.

તમારી બંદગીઓમાં હંમેશા નિયમિત રહેશો.

તમારી મજહબી ફરજોમાં નિયમિત રહેશો,
એવું અમો ચાહીએ છીએ.

અમે ઈચ્છીએ છીએ કે તમે એમ નહિ
સમજતા કે તમે તમારા રસ્તાના (મંજીલના)
આખરી છેડા સુધી પહોંચી ગયા છો.

પણ તમારે એ યાદ રાખવું જોઈએ કે તમે
હુંમેશા તે રસ્તાના શરૂઆતના તબક્કામાં છો.

રૂહાની બાબતોમાં અમો ઈચ્છીએ છીએ કે
તમે એ યાદ રાખો કે આપણી જમાતની
પ્રણાલીકાઓ તેરસો વરસથી ચાલી આવે છે.

અમો ઈચ્છીએ છીએ કે અમારી જમાત
ઈમામતની રસીને મજબૂતપણે વળગી રહે.

અમો ઈચ્છીએ છીએ કે તમે આપણી
પ્રણાલીકાઓને મજબૂતપણે વળગી રહો.

અમો ઈચ્છીએ છીએ કે તમો નિયમિત
જમાતખાને હાજરી આપો અને આપણી
જમાતની પ્રણાલીકાઓનું પાલન કરો.

જમાતખાનામાં નિયમિત રીતે હાજરી આપો
અને નિયમિત રીતે દુઆ બંદગી ગુજરારો કારણ
કે માત્ર આ એકજ વસ્તું છે કે જે તમને સાચું
સુખ આપી શકશે.

તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું
જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ.

અમને લાગે છે કે આપણી યુવાન પ્રજાને
ળીનાન શીખવવાની ઈસમાઈલીયા એસોસીએશન
ઉપર ખાસ કરીને જે જવાબદારી અને ફરજ છે
તેને અંજામ આપશે તોજ આપણી આ અદ્ભૂત
પ્રણાલીકાઓને આપણો ચાલુ રાખી શકીશું,
નહિંતર આપણો આપણો અગત્યનો એવો
ભૂતકાળનો અમૂક વારસો ગુમાવી બેસશું કે જે
આપણી જુંદગી પર્યત અને હવે પછી જનમવાના
છે તે અમારા રૂહાની બચ્ચાઓનાં જીવન માટે
અતિ અગત્યનો છે.

સદીઓ થયા જુદા જુદા ઈમામોના વખતમાં
મજહબી રીત રીવાજો એક સરખાજ રહ્યા છે.

અમો માનીએ છીએ કે અમારી કોમી
જુંદગીમાં ફેરફારો થવાજ જોઈએ.

દુન્યવી બાબતો માટે ઈમામ પોતે નિર્ણય લ્યે છે. અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છીએ.

પરંતુ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે એ જરૂરી નથી કે અમારા મજહબી સિદ્ધાન્તોમાં પણ થવા જોઈએ.

અમો તમોને વખતો વખત દુન્યવી બાબતોને લગતા ફરમાનો કરીએ છીએ પણ જે બાબત અગત્યની છે અને હંમેશા અગત્યની રહેશે તે એ છે કે અમારા દૃહાની બચ્ચાઓએ પોતાના મજહબનો અર્થ સમજવો જોઈએ.

સદીઓ થયા જુદા જુદા ઈમામોના વખતમાં મજહબી રીતે રીવાજો એક સરખાજ રહ્યા છે.

તેઓએ નિયમિત રીતે પોતાના મજહબની પાબંદી કરવી જોઈએ પછી તે (૫૦૦) વરસ ભૂતકાળમાં હોય કે (૫૦૦) વરસ ભવિષ્યમાં હોય.

ફરમાન મુખારક ૩૧૩ ... (૭૧)

અમો ઈચ્છીએ છીએ કે તમે ભૂતકાળની જેમ તમારી ઈબાદત બંદગી નિયમિત ગુજરતા રહેજો.

માવિત્રોની એ ખાસ ફરજ રહેશે કે અમારા રૂહાની બચ્ચાંઓ, અમારા નાના રૂહાની બચ્ચાંઓને તેમનો મજહબ શીખવે. અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી.

તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે એકલી કેળવણીજ પૂરતી નથી, તમારામાં શ્રદ્ધા અને મજહબ માટે પ્રેમ પણ હોવાં જોઈએ.

સૌથી વધારે મહત્વની બાબત તમારે એ યાદ રાખવાની છે કે દુન્યવી જીવન એ કાંઈ તમારું ધ્યેય નથી.

સૌ પ્રથમ તમારે તમારી મજહબી ફરજો અને તમારી બંદગીમાં નિયમિત રહેવું જોઈએ.

યાદ રાખો કે તમારી પાસે અહીં (આ દુનિયામાં) જે કંઈ છે તે ટુંક મુદ્દત માટે છે. તમો આ પૃથ્વી પર અમયાદિત સમય સુધી રહેવાના નથી.

અમો નથી ઈચ્છા કે અમારા રૂહાની બચ્ચાઓ એ ભૂલી જાય, કે આ પૃથ્વી ઉપરનું જીવન અનંતતામાનો માત્ર એક ઘણો ટુંકો માર્ગ છે અને તમારે એમ ન માનવું જોઈએ કે તમો અહિ માત્ર એકજ હસ્તી માટે છો અને ત્યાર પછી તમારે કોઈ હિસાબ આપવાનો નથી.

કોઈ પણ રૂહાની બાળક માટે આ દુન્યવી બાબતો સર્વોપરી અગત્યતા ધરાવતી નથી, તે ક્યારેય ધરાવશે પણ નહિ.

તમારે એ સમજવું જોઈએ કે આ દુનિયાની અંદર આપણો ઘણા થોડા સમય માટે છીએ.

આ દુનિયાનો જ્યારે આપણો ત્યાગ કરીશું ત્યારે દુન્યવી ઉત્ત્રતી માટે જે કંઈ કર્યું હશે તે આપણો આપણો સાથે લઈ જઈ શકશું નહિં.

માટે દુન્યવી વસ્તુઓ પાછળ અવિચારી બની ભટકવું એ માત્ર નાદાનીજ નહિ પણ મોટી મુર્ખતાજ છે.

જેઓ અમર્યાદિત દૌલત ધરાવે છે પરંતુ તેઓ જાણતા નથી કે તેઓનું આ ધન આવે છે ક્યાંથી? તેનું મુલ્ય કેટલું છે? અને તે શા માટે છે? વ્યવહારુ રીતે પણ જોતાં આ ધનદૌલત આશીર્વાદરૂપ બનવાને બદલે તે વધુ અને વધુ બોજારુપ બનવાની વલાણ ધરાવે છે.

પૈસા અને દુન્યવી નિયામતો એ ખરી ફિટેમંદીથી ઘણાંજ દૂર છે.

એવો સમય આવે કે તમારે ન નિવારી શકાય તેવી લાલચોનો સામનો કરવો પડે, ત્યારે મજૂહબના સંપૂર્ણ જ્ઞાન થકી તેની ઉપર વિજય મેળવી શકશો.

તમારા વડીલોએ ક્યારે પણ ન આપી હોય
તેવી સલાહ અમો તમોને આપીએ છીએ.

જો તમે ઈલ્મ થકી તમારી જતને સજાવશો
અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા
બનશો.

આવતી પેઢીઓ દરમ્યાન તમે વધતી જતી
ભૌતિક વિપુલતા અને દુન્યવી પ્રવૃત્તિ ધરાવતા
એવા જગતમાં જીવી રહ્યા હશો કે જેમાં
માનવીના મોટા વર્ગનું બુદ્ધિકૌશલ્ય અને
વિચારશક્તિ તમને દુન્યવી લાભો પૂરા પાડવા
તરફ વળેલા હશે.

કદાચ એક દિવસ અમુક માનવીઓના મનમાં
મજૂહભના અર્થ અને તેની જરૂરત વિષે કંઈક
ગુંચવાણ પેદા થશે.

જો અમારા રૂહાની બચ્યાંઓ પોતાના માનસને સર્જાએલાને બદલે સર્જક ગણવા માંડશે. અને તેઓના દુન્યવી સુખચેનને જોતાં તેઓ રૂહાની નમૃતાને બીન જરૂરી માનવા પ્રેરાય એવી રીતે તેઓ પોતાના જીવનનું ઘડતર કરશે તો અમો તમને હમણા કહી શકીએ છીએ કે સાચા અને વાસ્તવિક સુખ અમારી દુઆ છે કે જેનો તમને અનુભવ થાય તે તમારા હદ્યને કદી સ્પર્શ નહિં કરે.

તમારી આસપાસના દુન્યવી વાતાવરણનું કોઈ પણ ઝડપી પરિવર્તન તમારા માટે અતિશય દુખદાયક, અતિશય ચિંતા કરાવનારું અને હતાશા લાવનારું બનશે.

તમારે ઠાઈ માઈ ભર્યું કે અમીરી જીવન જીવવું ન જોઈએ કે જે માત્ર તમનેજ નહિં, પણ તમારા બાળકોને અને તમારા કુટુંબને નુકશાન પહોંચાડે છે.

તમો સમજુ નહીં શકો કે દુન્યવી લાભોએ
તમારા હદ્યમાં માત્ર અસંતોષ અને ભ્રમણા પેદા
કર્યા છે.

જો તમે ઈલ્લ થકી તમારી જાતને સજાવશો
અને તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા
બનશો.

તમારે તમારી આવકની મર્યાદામાં રહેવું
જોઈએ. તમારે ઠાઠ માઠથી કે ખર્ચણ રીતે
રહેવું ન જોઈએ કારણ કે તે ન તો અમારી
જમાતોના હીતમાં છે કે ન તો તમારા બચ્ચાઓ
કે તમારા પૌત્રાઓ કે તમારા પરપૌત્રાઓના
હીતમાં છે.

અમો તમોને ભારપૂર્વક ફરમાવીએ છીએ કે
તમે સાવચેતીથી અક્કલ હુશિયારીથી અને
કરકસરથી રહો. ખાનાવાદાન.

જો તમે ઈલ્લુ થકી તમારી જાતને સજાવશો અને
તે મુજબ અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો.

તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડુ
જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ.

આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ
બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના
મજહબ વિષે માહિતી મેળવવાની જેઓએ નેમ
રાખી છે તેઓને, અમો અમારા ઉત્તમ ઘારભર્યા
દુઆ આશિષો ફરમાવીએ છીએ.

અમોને એ જાણીને અતિષય હર્ષ થયો છે કે,
જે સ્થળે અમારા દાદાજાનનો જન્મ થયો હતો, એ
સ્થળે પાકિસ્તાનની જમાતે અમારા માટે એક ઘર
ધરાવવાનું શક્ય બનાવ્યું છે.

તમો કોઈ વેળાએ બસમાં અગર બીજે ક્યાંએ
જઈ રહ્યા હો, અને જો તમારા પાસે તરફીહ
હોય તો અચુક ત્યાંજ અને ત્યારેજ તમારી
દુઆ ગુજારી લ્યો, અને તેમાં જરાએ અચકાઓ
નહીં અથવા શરમાઈને મુલતવી રાખો નહીં.

સાચા સુખની એક માત્ર ખાત્રીપૂર્વકની ચાવી છે, તે છે ઈબાદત.

યાદ રાખો જે અમો તમોને અવારનવાર દુન્યવી ફાયદા માટે ફરમાન ફરમાવીએ છીએ પરંતુ અમો જોઈએ છીએ કે તમારામાંના ઘણા ખરા દુનિયા પાછળ લાગેલા હોય છે અને દુન્યવી પ્રગતિનેજ પોતાના જીવનનો ધ્યેય બનાવેલ છે. આવા લોકો અવળે રસ્તે દોરવાઈ ગયેલા છે.

ખરો માર્ગ એ છે કે તમો તમારી બંદગીના વખતને બરાબર સંભાળો અને એકાગ્રતાથી ખરું સુખ મેળવો.

તમારે યાદ રાખવું જોઈએ કે ગરીબ કે પૈસાદાર સર્વે માટે બંદગી જરૂરી છે.

તમારી દુકાનો, તમારા મકાનો, તમારી સર્વે ઔલાદ, પૈસા વિગેરે બધું અહીંજ રહી જશે; માત્ર તમારો દુહ એકલોજ જશે. આ બાબત તમે કદી પણ ભૂલશો નહિ.

ઇજરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું;

જ્યારે અમે ફરમાન માટે મોકું ઉઘાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ પણ, પરીક્ષા કરનાર મોમન હોય તેજ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે, તેઓને શું ચીજ મળી છે.

પણ તમે નાદાન છો.

ઈસા પયગમ્બર નાદાન પાસેથી નાસી ગયા હતા. તેવા નાદાન તમે છો; ત્યારે મોતીના ઢગલામાંથી શું ફાયદો તમે હાસલ કરી શકશો?

અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેઓ ઈન્સાન છે તેઓ જવાહીર ઊંચકી લેશો, જેઓ હેવાન છે તેઓની નિગાહ ધાસ ઉપર રહેશો અને જવાહીરને છોડી આપશો.

તમે ઈન્સાન રૂપમાં છો, ખુદાવંદતાલાએ
તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે,
તમને મહોબ્બતથી સતપંથ દીનમાં જન્મ આપ્યો
છે પણ હેઠ છે કે, ઢોરની મિસાલ જન્મ ચાલ્યો
જાય છે અને ઈન્સાન પાછો ખાકમાં દાખલ થઈ
જાય છે.

રોજ ક્યામતમાં બીજી જાતોને તો એક બહાનું
પણ છે કે, તેઓને સતપંથ દીનની ખબર નહિ
હતી. તમે અરબ, બદકશાની, ખોજા, મુમના તથા
બીજા જે ટલા ઈસમાઈલી સતપંથી છો તેઓ રોજ
ક્યામતના દિવસે કાંઈ પણ બહાનું કાઢી શકશો
નહિ.

ઈન્સાન ઘ્યાલ કરતો નથી કે, ભરણ પછી
ક્યામતમાં તે એવો જવાબ આપશે કે ફલાણાએ
મારા રૂહને ફરેબ દીધો તો તે બહાનું કાંઈપણ
ચાલવાનું નથી.

તમારી હવેની આટલી જુંદગી છે તે, બે ફાયદે
અને બેખબરીથી કેટલોક વખત ખોતા રહેશો?

તમારા આદમના અવતારને ઓળખો, ઈન્સાન
અવતાર તરીકેનો તમારો મરતબો સમજો.

ઈન્સાન થઈને ક્યાં સુધી હેવાન જેવા રહી જશો?

દુનિયા ઉપર ક્યાં સુધી મહોબત રાખશો? ક્યાં
સુધી દુનિયાની બાળ ખાધા કરશો?

તમે ઈન્સાન થયા ત્યારે તમને જન્મ તથા
મરણ છે. ઈન્સાન જન્મ અને મરણની વચ્ચમાં
ફર્યા કરે તેમાં શું ફાયદો થાય?

કોઈ માણસ પાસે આખી બાદશાહી હોય,
એટલે કે તેને ઘેર આખી દુનિયાનું રાજ હોય,
તેની પાસેથી બાદશાહી છીનવી લઈને, તેને
ફરીર બનાવવામાં આવે તો, તેની કેવી ખરાબ
હાલત થાય; હવે તમે ઈન્સાન રૂપી ઉત્તમ દેહીમાં
આવ્યા પણી, ફિરસ્તા થવાને બદલે ઈન્સાન
મટીને હેવાન જેવા બનશો તો, તમારી પણ
એવીજ ખરાબ હાલત થશે.

ઈન્સાનમાંથી ફિરસ્તો થઈ શકાય છે. પરંતુ ઈન્સાનમાંથી ફિરસ્તા થવું તેમાં ઘણી મહેનત છે.

તમારા રૂહનો અવતારપહેલાં પત્થરથી શરૂ થાય છે.

અવ્વલમાં ઈન્સાન માટી તથા પત્થર રૂપે હતો.

મૌલાના રૂમી કહી ગયો છે કે, હું પત્થર હતો. તેમાંથી ઝાડમાં પેદા થયો, તેમાંથી બદલીને કીરીમાં પેદા થયો, ત્યાર બાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો; તેમાંથી ઈન્સાન થયો છું. ઈન્સાનમાંથી શું થઈશ? મલાએક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતાં ઉંચે જઈશ.

ઈન્સાન તે છે, જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તે સિવાય આ દુનિયામાં ઈન્સાન માત્ર જનાવર મિસાલ છે.

જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મહોબ્બત પણ વધારે કરે છે.

પીર સદરદીન હતો, તે તમારા જેવો એક માણસ હતો. તમારાથી કાંઈ ફરક નહિ હતો, તેની આંખો, કાન વગેરે તમારા જેવાજ હતા, કોઈ પણ ખોજો હશે તે કહેશે કે, પીર સદરદીને ખોજા બનાવેલા છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દીનબંધુ હતો.

પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનનો હતો.

પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે, ખુદા મારી પાસે છે.

તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ.

અક્કલવાળો માણસ કહેશે કે, ઈન્સાન એ એક મોટી ચીજ છે.

સારા નરસાને બરાબર ઓળખે તે ઈન્સાન છે.

ફરમાન મુખારક ૩૧૩ ... (૮૪)

હવે જુઓ કે, સારા અને નરસા વચ્ચે શું ફરક છે?

પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું.

એવું ન બને કે રૂહ અહીંયાજ રહી જાય
અને ઢોર માફક ખાય તથા સુઅ.

સમજદાર ઈન્સાનને મોટી ઉમેદ રાખવી
જોઈએ; તે એ છે કે, રૂહ જે ઠેકાણોથી આવ્યો છે
તે અસલ મકાને પહોંચે.

રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર* છે.

જ્યારે અસલની ખબર ન પડે, ત્યારે શું વળ્યું?

અસલ મકાન કરતાં બીજું કયું મોટું મકાન છે?

તમારું અસલ મકાન ઘણું મોટું છે, પણ હવે
ઘણું દુર છે.

તમારું મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો.

અસલ મકાને પહોંચવા માટે નામર્દીને
જડમૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ.
હિયકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી
અસલ મકાને પહોંચાય છે.

તમે જ્યારે સિજદો કરો ત્યારે માગો કે અમને
અસલ મકાને પહોંચાડો.

જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે,
ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા
પાસે જઈ પહોંચું ! તમે પણ તેવા થાઓ.

તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું
જોઈએ.

આ દુનિયામાં બે જાતના મોમન છે, જેમાં એક
બદનના મોમન છે, તથા બીજા રૂહના છે.

જેઓ બદનના મોમન છે, તેઓ અહીંજ રાજુ
થાય છે અને આ દુનિયામાં જ રહેવાને રાજુ છે.
તેઓની જગ્યા જમીનમાં હોય છે. આ વડાઈના
મોમન છે, તેઓ આખરે જમીનમાંજ જાય છે.

બીજા જે રૂહના મોમનો છે, તે એવા થાય છે કે,
દીનના કામમાં તેઓ આગળ અને આગળ કદમ
ભર્યા કરે છે. તેઓ ઉભા રહેતા નથી તે મોમનો
નિરંતર આગળ વધ્યાજ કરે છે. આવા માણસો
બહેસ્તથી પણ ઊંચે જશે.

બહેસ્તથી પણ વધારે પાક એક જગ્યા છે.
ત્યાં રૂહને પહોંચવું જોઈએ.

તમારામાંના, તમારા કરતાં વધારે અક્કલવાળા
હતા, તેઓ અમારે રસ્તે ચાલ્યા.

મિસાલ મનસુર ચાલ્યો;

મનસુર માટે બહેસ્ત મૌજુદ હતી; પણ તે
કહેતો કે, ખાલી બહેસ્તમાં જઈને શું કરું; જ્યાં
સુધી મગજને ચાખીશ નહિ ત્યાં સુધી પાછો નહિ
વળું, આગળ વધીશ.

રૂહની અસલ ઉમેદ છે તે બીજું જવહર છે.
જ્યારે અસલની ખબર ન પડે, ત્યારે શું વણ્યું ?

હાલ તમારી બજે બાજુએ બે રસ્તા છે.
એક તરફ એક સડક ગઈ છે તથા બીજી તરફ
બીજી સડક ગઈ છે એક સડક હેવાન એટલે
બદનની છે અને બીજી સડક રૂહની એટલે
ફિરસ્તાની છે.

ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે.

જો તમે એ સડક પકડશો તો સાતમે
આસમાને જઈ પહોંચશો.

અગર એ સડક છોડી આપશો તો, તમારો રૂહ
જમીન ઉપર જ રહેશે.

સાતમા આસમાન ઉપર જ સડક જાય છે
તેનો ખ્યાલ કરો.

તમે તમારો સુકો રસ્તો શોધો.

તમારો સુકો રસ્તો સાતમા આસમાન ઉપર છે.

જ્યારે ત્યાં તમે પહોંચશો ત્યારે સુકી જમીન
તમને મળશે અને તમારું દિલ પણ તમોને ખાત્રી
આપશો.

આ દુનિયા રૂપી દરિયામાંથી સાતમા આસમાનની
સુકી જમીનને પહોંચવા માટે, રસ્તામાં જ સડક છે,
તે પર શેતાન ઘણી જાતના વરસાદ વરસાવે છે.
ફિતના, દુશ્મની, જુહું બોલવું વગેરે હજારો જાતના
વરસાદ તે રસ્તા ઉપર વરસાવે છે અને મોમનને
સુકી જમીને પહોંચવા આપતો નથી.

મહેનત કરીને ઈલમ શીખો અને હિંમત રાખો.
જેનામાં હિંમત છે તે સાતમા આસમાન સુધી
પહોંચી જય છે.

મારા વાસ્તે ઘણી મહેનત છે. “એ” બેઈલ્ભી
કેમ રાજી થાય ? “એ” હકીકતને પકડતો નથી.
એને હકીકત જોઈતી નથી.

જેઓ બેઈલ્ભી છે તેઓ હકીકતને છોડી આપે છે.

પણ જેઓ હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે.

જેમ આગળ (૧)ઇસા (૨)પીર સદરદીન
(૩)નાસર ખુશરૂ (૪)પીર શમ્સ (૫) મૌલાના
રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા
ઉપર ચાલ્યા.

આ રસ્તો નાદાનના માટે બહુ મુશ્કીલ છે.

પણ જે દાના અક્કલવાળો હશે તે કહેશે
કે, આ રસ્તો સારો છો.

હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે
તમે આજાદ થશો.

ખોટું ન બોલવું. મારા દીનમાં ખોટું બોલવાની
મનાઈ છે.

પૈસા સાથે દિલ બાંધવું નહિ.

ઘણા પૈસા કમાવો તેમાં ખુશી પણ નહિ થશો.

મહેનતથી કમાવેલા પૈસા જતાં રહે, તો
દિલગીર થવું નહિ.

ખુદા ન કરે ને કોઈનો છોકરો ગુજરી જાય
તો તેણો અફસોસ ન કરવો.

મોમનને દુનિયામાં કાંઈ પણ નુકશાની થાય
છે તેનું તેને દુઃખ થતું નથી.

દુનિયામાં મોમનને નુકશાની થાય તો પણ ગમ ન કરે. દીનનો ઈતોકાદ અને ઈમાનની નિશાની એજ છે.

ઈન્સાન ઉપર જે દુઃખ પડે છે, તે મોમનને સુખરૂપ લાગે છે.

ઈન્સાન ઉપર બિમારી, કોઢીયાપણું રગતપીત વિગોરે દરદ આવે છે, પણ મોમન તેનો અંદેશો રાખતો નથી અને નાખુશ બનતો નથી.

મોમનને અગર રગતપીતનું દરદ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સર્ફેદ હોય છે. તેના ઉપર ગમે તેટલા દુઃખ આવી પડે. તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી.

ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો, તમે પણ ફનાફિલ્હાહ થાઓ.

તમે વિચાર કરો કે, અમે ફના થઈએ. જે કોઈ ચાહે અને કોશીષ કરે તે ત્યાં પહોંચી શકશે. પણ તમારા ગુન્હા તમને પહોંચવા આપતા નથી. તે ગુન્હાઓએ તમને કેદખાનામાં બંધ કીધા છે.

તમે ફિલસુઝી પડો તો ખુદાવંદતાલાની નજીક થઈ શકો.

પીર શમ્સ, પીર સદરદીન, મૌલાના રૂમ, ફિલસુઝી ઘણી પડ્યા હતા, તેમજ કુરાને શરીર પણ માયના સાથે પડ્યા હતા.

રૂહ ક્યાંથી આવ્યો? પાછો રૂહ ક્યાં જશે? જેઓ ફિલસુઝીની કિતાબો પડ્યા છે, તેઓ એ સર્વ જાણો છે.

પીર શમ્સ, પીર સદરદીન, મૌલાના રૂમ, એઓ જ એવા થઈ શક્યા એમ નહિ સમજતા.

તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો.

ફરમાન મુખારક ૩૧૩ ... (૬૨)

આવો ઈલ્ભ તમારા ઉપર વાજબ છે.

હું તમારા માટે ફિલસુફી રાખીશ તે પડજો
તથા સમજજો તેમાં મોટી હિંમત છે.

હિંમતવાળાનો રૂહ જલદીથી દરિયામાં મળી
જાય છે.

તમારો રૂહ એક નદીની મિસાલ છે.

અમે એક દરિયો છીએ.

તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં
એટલે અમારા પોતામાં છે છેવટે તમે દરિયામાં
મળી જશો.

જુઓ આ કચ્છના મુલકમાં જે નદીઓ છે, તે
દરિયામાં મળી શકતી નથી. રસ્તામાંજ સુકાઈ
જાય છે.

એ પ્રમાણો જે લોકો બે હિંમત છે તેનો રૂહ
પણ કચ્છની નદીઓની માઝક રસ્તામાં જ
સુકાઈ જાય છે.

તમે ઘણા જ બેહિંમત છો, તેથી તમારો રૂહ
જલદીથી ત્યાં પહોંચી શકતો નથી.

તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા આપો
નહિ, પણ જલદીથી દરિયામાં મળી જવા આપો.
તમે આ બાબત પર સારી રીતે ઘ્યાલ કરજો.

તમે ઉંઘમાં પડેલા છો તેથી, તોપના અવાજ
સંભળાતા નથી. સુતેલા માણસને ઉઠાડવામાં
આવે છે તેમ, અમે તમને જગાડીએ છીએ કે
ઉઠો! ઈબાદતમાં મશગુલ થાઓ, ભૂલો નહિ!
ત્રણ વાગાની ઈબાદતમાં ઘણોજ ફાયદો છે. એક
તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ
ઈબાદત એવું ઈબાદતનું જબરુ વજન છે.

ખુદાને મળવું ઈબાદત ઉપર છે. ઈબાદત
ઈમાન ઉપર છે. વળી ઈમાન હાંસલ થવું એ
ઈશ્ક ઉપર છે.

ઈશ્ક કેવો હોવો જોઈએ?

ફરમાન મુખારક ૩૧૩ ... (૯૪)

જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો
પાણી માટે તલબ કરે છે, તેવીજ રીતે રૂહને પણ
ઈમામનો ઈશ્ક હોવો જોઈએ. ઈમામના બદન
ઉપર નહિ, પણ ઈમામના રૂહ ઉપર ઈશ્ક હોવો
જોઈએ.

જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તેજ ખુદા
પરસ્ત છે.

ઈન્સાનને લાજમ છે કે ખુદાવંદતાલાનો
ઈશ્ક દિલમાં રાખે.

ઈન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે
છે અને કેટલી બેકરારી કરે છે? તેના કરતાં
હજારો દરજજે વધારે ખુદાવંદતાલાનો ઈશ્ક
રાખવો જોઈએ.

તમે મોમન છો તો ખુદાવંદતાલા ઉપર
આશક થાઓ.

હકીકતીઓનો ઈશ્ક ઔલાદ, સ્ત્રી તથા પૈસા
ઉપર નથી હોતો, પરંતુ ખુદાવંદતાલા ઉપર
હોય છે.

મોમન જેમ જેમ ખુદાવંદતઆલા ઉપર વધારે
અને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને
વધારે અને વધારે નજીક થતો જાય છે; તે
ખુદાને પ્રત્યક્ષ દેખે છે.

એવી જાતની મહોબ્બત તમે મારા માટે
તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી
સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય.

જ કોઈ રૂહાની ઈશક રાખે છે તેજ ખુદા
પરસ્ત છે.

જો ઈશક બરાબર હોય તો, ઈમાન રૂહ સાથે
એકજ થઈ જાય છે.

તમે ઈમાનની બરાબર સંભાળ રાખજો.

જેમ માણસો પોતાની દૌલત સંભાળે છે, તે
પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે
છે.

તમે તમારું ઈમાન મનસુર જેવું રાખો.

જુઓ મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો તો પણ તેણો પોતાનું ઈમાન મુક્યું નહિ.

જ્યારે મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ “અનલહક” નો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની નિશાની છે.

ઈમાન અમુલ્ય વસ્તુ છે અને ધણીને ઘારી છે. અમારા દાદા હ. મૌલા મુર્તજાઅલીને મોમન નુસેરી “અલ્લાહ” કહેતો હતો, તેને ૭૦ વખત કટલ કરવામાં આવ્યો તો પણ તેણો “અલી અલ્લાહ” કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે, અને એની ઔલાદ પણ સચ્યાઈવાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો.

જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન
સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું માટે
પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહિ.

જે શાખ્સ ઈબાદત નથી કરતો તે હકની રોજી
નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ
કરી તેનું ઈમાન લૂંટી લ્યે છે.

કેટલા દિવસ તમારા દિલને ઈબાદત વગરનું
રાખશો.

ઈબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર બને
ઉપર સરખો છે.

પૈસા ન હોય તો નહિ આપો પણ ઈબાદત
કરો.

જો ઈબાદત નહિ કરો તો જહન્નમમાં જશો
અથવા પાછા હેવાન થશો તેમાં શું ફાયદો ?

સલમાન ફારસ પણ તમારા જેવો માણસ
હતો. તે પોતાના અસલ મકાને પહોંચ્યો.

તમે પણ ઈબાદત કરી સલમાન ફારસ જેવા
થાઓ.

તમે ઈબાદત કરો તો પીર સદરદીન જેવા
થાઓ.

તમારે તમારી ઈબાદત છોડી દેવી જોઈએ નહિ.

જો કદાચ તમે બિમારીના બીછાના પર પડ્યા
હો, તો પણ ઈબાદત છોડતા નહિ.

જ્યાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાં સુધી
તમારી ઈબાદત છોડતા નહિ.

હુંમેશા ખુદાની ઈબાદત કરજો.

હરપળ, હર સાયત ખુદાને યાદ કરવા જોઈએ.

અગર તમે ભૂલી ગયા હો અને ગાફ્લ થઈ
ગયા હો, તો અમે તમને યાદ અપાવીએ છીએ.

ખુદાવંદતાલાની ઈબાદત કરતી વખતે
દુનિયાનો કોઈ પણ જ્યાલ દિલમાં રાખશો નહિ.

ફરમાન મુખારક ૩૧૩ ... (૮૮)

ઈન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, અને સારા
કામ કરે પછી મરી જાય, ત્યારે શું ફાયદો ?

તમે પીર સદરદીન જેવા થવાનું ધારો છો, તે
કેમ બની શકે ? તમારામાં હિંમત તો છે નહિ,
ત્યારે તમારાથી બીજું શું થાય તેમ છે ?

હંમેશા બંદગી કરવા છતાં જો આજાદીમાં ન
પહોંચો તો શું વળ્યું ?

તમે બંદેખુદા છો, ખુદા રહેમુર રાહેમીન છે
ત્યારે શું તમને કોઈ વખત આજાદ નહિ કરે ?
હું નથી કહેતો કે આ દુનિયા પછી પણ તે
આજાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા
રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર
આધાર રાખે છે, એ સઘણું તમારા હાથમાંજ છે.

અમે અમારા દિલથી તમને દુઅા કરીએ છીએ
કે, ખુદા યા ! તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે
આજાદ થાય. હકીકતી થાય ખરાબીથી દૂર
ભાગે. રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે.

ખુદા યા! તેઓને હકીકતી આંખો બક્ષ. આ
દુઆ સધળી દુઆ કરતાં વધારે છે.

અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે,
તેઓને જ કામ આવે છે.

સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો રોજો
રાખે. ત્યારે બાતુની આંખ અને કાન છે, તે ખુલે.

ઈન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને
પેઢા કરી શકે, પણ એવી રીતે જુએ કે ખુદાના
ભેદ અને કરામતની ખબર પડે.

તમે કહો છો કે, અમે મોમન છીએ; ત્યારે
અમે પુછીએ છીએ કે, જનાવરથી ક્યો હુનર
તમારામાં વધારે છે?

એક કલાક જ્યાલ કરજો કે રૂહ શું છે?
આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય.

આવા આવા વિચારો કરશો ત્યારેજ મોમનના
લક્ષણ તથા દીનની ખબર પડશો.

દરેક ઈન્સાનના રૂહ સાથે ઈમામનું નુર
જોડાયેલું છે.

જ્યારે તમે માણસને જુઓ છો, ત્યારે
માણસની શિક્ષણ જોવામાં આવે છે. હાથ, પગ,
મોહું, આંખો, સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ
દીઠામાં આવતો નથી.

તમે રૂહને જોવાની તજવીજ કરો.

તમારી ફરજીલત તથા સારો વખત રૂહને
ઓળખવાનો છે.

ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે. તમારા
હાથમાં છે. એ દીવો તમો સર્વેમાં છે. તેને તમે
જુઓ. તમે એને પુછો, તમે એને નહિ પૂછશો તો
તમને ક્યાંથી ખબર પડશો? તમારો મજહબ
ઘણો કઠણા તથા મુશ્કિલ છે.

કેટલાક હજાર વર્ષો થઈ ગયા તેમાં કેટલા માણસો તે મકસુદને પહોંચ્યા? હ. ઈસા, હ. રસુલ સ., મનસુર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખો જ હતો.

જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા.

મુર્તજાઅલીએ ફરમાવ્યું કે, “જેણો પોતાને ઓળખ્યો તેણો જાણો કે ખુદાને ઓળખ્યો.”

જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ-દોસ્તને જોઈએ છીએ.

ખુદાનો દરજો સમજ્યા અગાઉ પોતાનો દરજો સમજો. ત્યારબાદ ખુદાના દરજાની ખબર પડશે.

મોમનનો રૂહ તે અમારો રૂહ છે.

તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નૂરને જુઓ.

હું કહું છું કે, જે કાંઈ છે તે રૂહજ છે, માટે
તેની તપાસ કરો કે તે શું છે? તે ક્યાંથી
આવ્યો? તે નૂરની નિગાહ કરવી જોઈએ.

સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે એવો
રોજો રાખે; ત્યારે બાતુની આંખ અને કાન છે,
તે ખુલે.

ઈન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને
પેદા કરી શકે પણ એવી રીતે જુએ કે ખુદાના
ભેદ અને કરામતની ખબર પડે.

અક્કલવાળો માણસ કહેશે કે મારી આરજુ
આજાદીની છે, હું આજાદી પછવાડે દોડું છું, હું
દોડીશ, હું શોધીશ !

અક્કલવાળો મોમન હોય, તેના માટે દુનિયા
જહનમ છે.

અગર બાદશાહ હોય તો પણ દુનિયા
જહનમ છે.

જો હજાર બે હજાર કે કરોડ રૂપિયાની દૈલત હોય, ઉમર પણ સો બસોની હોય, તો પણ સધણું જેર બરાબર છે.

અમારા ફરમાન તમાને સખત લાગે છે અને મુશ્કીલ માલુમ પડે છે. પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ.

જેવી રીતે છાપા, ન્યુઝ પેપર વાંચી જાઓ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો?

જેમ જમીનમાં બી વાવવામાં આવે છે, તેમ અમારા ફરમાન તમારા દિલમાં રોપજો, તેમાં સારા સારા ફળ ઉત્પત્ત થશે.

અમારા ફરમાન ઉપર બે કલાક વિચાર કરજો.

અમારા ફરમાન જેઓ સમજ શકશે તેને ભીઠાશ લાગશે.

અમારા ફરમાનને કિંમતી સમજજો. જો મામુલી સમજ શો તો, નુકશાન થશે.

ફરમાન મુખારક ૩૧૩ ... (૧૦૫)

ફરમાન ધ્યાનમાં નહિ લીયે તે મુર્ખ નાદાન છે.

નાદાન દીનનો દુશ્મન છે.

જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને
કાન આપતા નથી.

અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા
કાનથી કાઢી નહિ નાખતા.

અમારા ફરમાનની ખબર તમને આખરતમાં
પડશે.

અમારા ફરમાન પ્રમાણો નહિ ચાલશો તો,
પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરુંજ
તમારા માથામાં મારવામાં આવશો, ત્યારે તમે ત્યાં
પોકાર કરશો અને કહેશો કે, “તૌબા તૌબા” રાત
દિવસ ગુરુંજ માથામાં લાગશો.

બેખબરીનો ગુરુંજ ઘણાં જ ઈજા પહોંચાડનાર છે.

આતશના ગુરુંજથી ડરીને ધાસ્તીના લીધે

ફરમાન મુખારક ઉઠ ... (૧૦૭)

ઈબાદત કરે, તે મોમન નથી; પણ ખરું ડરવું એ
છે કે, ખુદાના દીદારથી દૂર ન થવાય તેનાથી
ડરવું જોઈએ.

મોમનનું દિલ છે તે ખુદાવંદતાલાનું ઘર છે.

મોમનના દિલની ખુબી એવી છે કે, અમો તેના
દિલમાં રહીએ છીએ.

તમારી પાસેથી અમે ન તો માલ માગીએ
છીએ, ન તો જાન માગીએ છીએ; ફક્ત તમારું
દિલ માગીએ છીએ.

હવે પછી પોતાના દિલથી કરાર કરો અને
તમારા ખુદાવંદને તમારા દિલમાં જગ્યા આપો.

જ્યારે તમારું દિલ રાજુ રહે ત્યારે ખુદા રાજુ રહે.

તમે દુનિયામાં કેદમાં છો, ત્યાં સુધી રાજુ
નહિ થાઓ.

જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને
નસિહતના બોલ સમજાવવા જોઈએ.

તેઓ એમ ન કહે કે, દીનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા.

દીન અને નસિહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઈએ તે જ્યારે પહોંચતા નથી ત્યારે તેનું હિલ દરેક ઠેકાણો ફરતું ફરે છે.

તમારા દીનમાં તથા બીજાના દીનમાં કેટલો બધો ફરક છે? તમે ખ્યાલ કરો. તમારો દીન “રૂહાની” છે અને બીજાઓનો દીન “જીસ્માની” છે.

“રૂહાની” તથા “જીસ્માની” દીનમાં કેટલો બધો ફરક છે? તે મુખી કામડીયા બચ્યાંઓને નહિ સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસિહતના બોલ નહિ લાગે તો જીસ્માની દીન બચ્યાંઓના ધ્યાનમાં બેસી જશે.

દરેક જમાતની ફરજ છે કે, નાના મોટા સર્વને અમારા ફરમાનની યાદી આપતા રહે.

જેઓને ઈલમની ખબર નથી, તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો.

તમે હકની વાત જાણતા હશો, છતાં ગીજાને નહિ કહો તો તમને ગુન્હા થશે.

તમે મોમન હો, પણ થોડી કસર હોય, તે કામ ન આવે.

તમને ઈલમ ગીનાન આવડતા હશે. માઅના પણ આવડતી હશે, પણ જો તમે હુંમેશા જમાતખાનામાં નહિ આવો તો કોઈ ચીજ તમને ફાયદો કરશે નહિ. આ મોટી નસિહત છે.

મારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહિ ? હું મુશ્કીલ સમજુ છું.

બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે ત્રણ વખતની દુઆ કરી પણ ચુકવી નહિ. હુંમેશા દુઆ વખતે જમાતખાનામાં હાજર રહેવું અને ત્યાં જ દુઆ પડવી.

ફરમાન મુખારક ૩૧૩ ... (૧૦૮)

પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાજર ઈમામ
તેમજ સુલતાન મુહમ્મદશાહના અહીંથી શરૂ થતા
ફરમાનની ૪૮ કરીઓની સાંકળ રૂહાની ઈલ્મની
જરૂરત તથા સાચી સમજ માટેની છે, જે સમજવી
જરૂરી છે.

પવિત્ર નુર મૌલાના શાહ કરીમ હાજર ઈમામે
ફરમાવ્યું:

અમારા દાદાએ જુંદગીના છેવટ સુધી પોતાના
રૂહાની ફરજંદોની ભલાઈ માટે કાર્ય કર્યું હતું.
અમો પણ અમારી જુંદગી તમોને અર્પણ કરીએ
છીએ.

એવણ અમારા માટે પ્રેરણાદાયક હશે. અને
અમના નકશો કદમ ઉપર ચાલવાની હુંમેશા
અમારી ખ્વાહીશ રહેશે.

સેકડો વરસથી અમારા રૂહાની બચ્યાઓ
ઈમામતની રસ્સી દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે

સદીઓ થયા જુદા જુદા ઈમામોના વખતમાં
મજહબી રીત રીવાજો એક સરખાજ રહ્યા છે.

ફરમાન મુખારક ૩૧૩ ... (૧૧૦)

અમો માનીએ છીએ કે અમારી કોમી જુંદગીમાં ફેરફારો થવાજ જોઈએ.

કુન્યવી બાબતો માટે ઈમામ પોતે નિર્ણય લ્યે છે. અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છીએ.

પરંતુ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે એ જરૂરી નથી કે અમારા મજહબી સિધાન્તોમાં પણ થવા જોઈએ.

તેઓએ નિયમિત રીતે પોતાના મજહબની પાબંદી કરવી જોઈએ પછી તે (૫૦૦) વરસ ભૂતકાળમાં હોય કે (૫૦૦) વરસ ભવિષ્યમાં હોય.

અમો ઈચ્છીએ છીએ કે તમે ભૂતકાળની જેમ તમારી ઈબાદત બંદગી નિયમીત ગુજરતા રહેજો.

સાચા સુખની ખાત્રીપૂર્વકની માત્ર એક ચાવી છે, તે છે ઈબાદત.

અમને લાગે છે કે આપણી યુવાન પ્રજાને ગીનાન શીખવવાની ઈસ્માઈલીયા એસોસીએશન ઉપર ખાસ કરીને જે જવાબદારી અને ફરજ છે તેને અંજામ આપશે. તો જ આપણી આ અદૃભૂત પ્રણાલિકાઓને આપણો ચાલુ રાખી શકીશું, નહિતર આપણો આપણો અગત્યનો એવો ભૂતકાળનો અમૂક વારસો ગુમાવી બેસશું કે જે આપણી જુંદગી પર્યાત અને હવે પછી જનમવાના છે તે અમારા રૂહાની બચ્ચાંઓનાં જવન માટે અતિ અગત્યનો છે.

અમારી નસિહત છે કે તમો અમારા દાદાશ્રીના ફરમાન પ્રમાણો ચાલશો તો દુનિયા અને આખરતમાં તમારું ભલું થશો.

રૂહાની બાબતોમાં અમો ઈચ્છાએ છીએ કે તમે એ યાદ રાખો કે આપણી જમાતની પ્રણાલીકાઓ તેરસો વરસથી ચાલી આવે છે.

અમો ઈચ્છાએ છીએ કે અમારી જમાત ઈમામતની રસીને મજબુતપણો વળગી રહે.

હજરત ઈમામ સુલતાન મુહમ્મદશાહે ફરમાવ્યું:

મોમનને વાજબ છે કે ઈમામ જે ફરમાન કરે
તે માનવું જોઈએ.

તમને વાજબ છે કે ઈમાન સાથે હજર જોમાનું
ફરમાન માનવું.

જેમ મુર્તજાઅલીનું ફરમાન માનતા હતા, તેમ
અમારા ફરમાન માનો અને તે પ્રમાણો અમલ કરો.

હમણાં અમારા ફરમાન માનશો તો આખરતમાં
દિલગીર થશો નહિ. અમારા ફરમાન નહિ માનો
તો આખરતમાં હેરાન થશો. તમે અક્કલવાળા હો
અને માનો તો સારું.

તમો સર્વેને લાજભ છે કે દીનની વાતો
એકબીજાને સંભળાવો, નહિં સંભળાવશો તો
ગુન્ઠા થશો.

તમે હક્કની વાત જાણતા હશો છતાં બીજાને
નહિં કહો તો તમને ગુન્ઠા થશો.

ફરમાન મુખારક ૩૧૩ ... (૧૧૩)

જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને
નસીહતના બોલ સમજવવા જોઈએ.

તેઓ એમ ન કહે કે દીનના બોલ અમારી
રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા.

દીન અને નસીહતના જે બોલ તેઓની
રૂહાનીને પહોંચવા જોઈએ તે જ્યારે પહોંચતા
નથી ત્યારે તેનું દિલ દરેક ઠેકાણો ફરતું ફરે છે.

“રૂહાની” તથા “જીસ્માની” દીનમાં કેટલો
બધો ફરક છે? તે મુખી કામડીયા બચ્ચાંઓને
નહિં સમજવે અને નાનપણમાં તેઓની રૂહાનીને
નસીહતના બોલ નહિં લાગે તો જીસ્માની દીન
બચ્ચાંઓના ધ્યાનમાં બેસી જશે.

જેઓને ઈલ્લની ખબર નથી તેઓને રૂહાની
બાબતમાં તમારા જેવા કરો.

જે ફરમાન અમે કર્યા છે તેને જીવતા જાગતાં
રાખવાં તમારા હાથમાં છે. તેને તમે લખો, વાંચો,
અમલ કરો તો ફરમાન જીવતાં રાખ્યાં ગણાય,
તેમ નહિં કરો તો તેને મારી નાખ્યાં ગણાય.

દરેક જમાતની ફરજ છે કે નાના મોટા સર્વને
અમારા ફરમાનની યાદી આપતા રહે.

તમે જમાતખાનામાં અમારા ફરમાન શા માટે
વાંચતા નથી ?

અમારા ફરમાન વાંચવા તથા તેની ભાયના
કાઢવાની જે કોઈ મના કરે છે તે દીનનો દુશ્મન છે.

ફરમાન ધ્યાનમાં નહિ લીએ તે મુર્ખ નાદાન
છે. નાદાન દીનનો દુશ્મન છે.

જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને
કાન આપતા નથી.

શેતાન જેવા ઈન્સાનની વાત સાંભળવી નહિ.
શેતાનની સુરત માણસના જેવી છે. તેની વાત
સાંભળવી નહિ.

ફરમાન ઉપર અમલ નહિ કરશો તો શેતાન
થશો. તકબુરીવાળા થશો.

ફરમાન મુખારક ૩૧૩ ... (૧૧૫)

મુરશિદનું ગમે તેવું ફરમાન માનવું જોઈએ.

આવી રીતનું ફરમાન કેમ થયું ? તે તમારે બોલવાનું નથી. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ. પણ ઈમામની અક્કલ મુજબ તમારે ચાલવું જોઈએ.

કેટલીક વાતો તમારી અક્કલમાં ન ઉતરે તો પણ પીર મુરશીદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ.

મોમનને વાજબ નથી કે પોતાની નિગાહમાં આવે તેમ કરે.

શરિયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો પણ તેમના દિલમાં અસર કરતા નથી.

અમારા ફરમાન જેઓ સમજી શકશે તેમને મીઠાશ લાગશે.

અમારા ફરમાન કિંમતી સમજજો, મામુલી સમજશો તો નુકશાન થશે.

ફરમાન મુખારક ૩૧૩ ... (૧૧૯)

પીર સદરદીને જે ગીનાનોની કિતાબો લખી છે, તેથી જુદા પ્રકારની કોઈ કિતાબ હરગીજ વાંચવી નહિ.

ઈસમાઈલી દીનભાઈ સિવાય બીજા કોઈ પાસેથી દીનની તાલીમ નહિ લેવી જોઈએ.

જેમ કે યહુદી, નસારા, સુન્ની, શીયા, હિન્દુ વિગેરે પોતાના ધર્મની તાલીમ પોતાના જ માણસો પાસેથી લીએ છે.

ગિનાન તથા ફરમાનમાં ફરમાવ્યું છે, તે પ્રમાણે ચાલો, તેની કિતાબો બરાબર પડો, તેની માયના કાઢો, તે ઉપર અમલ કરો.

પહેલા અમારા ફરમાન સાંભળો પછી ગિનાન, અમારા ફરમાન પ્રમાણે ચાલો, તો તમને ફાયદો થાય.

અમારા ફરમાનની તારવણી કરી જમાતને સમજણ પાડવી એ મિશનરીઓનું ખાસ કામ છે.

ફરમાન મુખારક ૩૧૩ ... (૧૧૭)

તમને ઈલમ ગિનાન આવડતાં હશે. માઝેના
પણ આવડતી હશે પણ જો તમે હંમેશા
જમાતખાનામાં નહિ આવો તો કોઈ ચીજ ફાયદો
કરશે નહિ. આ મોટી નસિહત છે.

માસ્તર હુંશિયાર હોવો જોઈએ તેમ રૂહાની
ઈલમથી પણ વાકેફગાર હોવો જોઈએ.

અમારા ફરમાન ઉપર ચાલે છે તેજ અમારા
ખરા મોમન છે.

યા અલી મદદ.

કલામે ઈમામે મુખીન ભાગ પહેલામાંથી નીચે
મુજબના ફરમાનો રૂહાની સમજણ માટે વાંચવા
જરૂરી છે.

પ્રકાશન ૧૯૫૦

સ્થળ	તારીખ	ફરમાન નંબર	પાના નંબર
મંજેવડી	૩૧-૧૨-૧૯૫૩	૨૦	૫૮
જંગબાર	૧૩-૦૮-૧૯૫૮	૪૫	૧૧૪
જામનગર	૦૪-૦૪-૧૯૦૦	૫૧	૧૩૦
વઢવાણ કેમ્પ	૧૮-૧૦-૧૯૦૩	૫૩	૧૫૭
વઢવાણ કેમ્પ	૧૯-૧૦-૧૯૦૩	૫૪	૧૫૧
રાજકોટ	૨૧-૧૦-૧૯૦૩	૫૫	૧૫૫
નૈરોબી	૦૫-૧૦-૧૯૦૫	૧૨૫	૨૭૫
દારેસલામ	૨૮-૦૮-૧૯૫૮	૧૯૦	૩૪૫

ફરમાન મુખ્યારક ઉંડ ... (૧૧૯)